



વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ

ગુડા ભવન, એલ. એન્ડ. ટી સર્કલ, કારેલીબાગ, વડોદરા-૩૯૦૦૧૮

ક્રમાંક:યુડીએ/ઓન સર્ટી/ 78703/2019

તારીખ : 27 Nov 2019

સર્ટી નંબર : 78703

ચલન નંબર : 225305

પ્રતિ: મહેસલાઈ નારણલાઈ રબારી

વિષય: મંજૂર પ્રિતિય પુનરાવર્તિત વિકાસ યોજનાના ઓન અંગેનું સર્ટીફિકેટ
(તા. 18-01-2012 થી અમલી)

અનું.: આપની તા. 27/11/2019 ની અરજી બાબત

ઉપરોક્ત વિષયે સરકાર શ્રી દ્વારા મંજૂર થઈ અમલમાં આવેલ પ્રિતિય પુનરાવર્તિત વિકાસ યોજના/
સરકારશ્રીએ મંજૂર કરેલ ફેરફાર/મુજબ મોજે દંતેશ્વર તાલુકે વડોદરા એ/પી.નં./રે.સ.નં./બ્લોક
નં. ૪૧૦ વીએમસી/ગુડા/ટી.પી.સ્કીમ નં. - ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમની
જોગવાઈ અન્વયે કલમ-17 ની પેટા કલમ (1) ના ખંડ (ગ) હેઠળ સરકારશ્રીએ મંજૂર કરેલ પ્રિતિય પુનરાવર્તિત
વિકાસ યોજના મુજબ રહેણાંક ઓન આર - ૧ માં આવે છે તથા સુચિત ૩૬.૦૦ મી. રસ્તો પસાર થાય છે.



આસીસ્ટન્ટ/જુનીયર ટાઉન પ્લાનર
શહેરી વિકાસ સત્તામંડળ
વડોદરા

SHREE VINAYAK BUILDCON

પ્રતિનિધિ

PARTNER



વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ

ગુડા ભવન, એલ. એન્ડ.ટી સર્કલ, કારેલીબાગ, વડોદરા-૩૬૦૦૧૮

ક્રમાંક:યુડીએ/ઓન સર્ટી/ 78704/2019

તારીખ : 27 Nov 2019

સર્ટી નંબર : 78704

ચલન નંબર : 225305

પ્રતિ: મહેષભાઈ નારણભાઈ રબારી

વિષય: મંજૂર દ્રિતિય પુનરાવર્તિત વિકાસ યોજનાના ઓન અંગેનું સર્ટીફિકેટ
(તા. 18-01-2012 થી અમલી)

અનુ.: આપની તા. 27/11/2019 ની અરજી બાબત

ઉપરોક્ત વિષયે સરકાર શ્રી દ્વારા મંજૂર થઈ અમલમાં આવેલ દ્રિતિય પુનરાવર્તિત વિકાસ યોજના/
સરકારશ્રીએ મંજૂર કરેલ ફેરફાર/મુજબ મોજે દંતેશ્વર તાલુકે વડોદરા એક/પી.નં./રે.સ.નં./બ્લોક
નં. ૪૧૧ વીએમસી/વુડા/ટી.પી.સી.નં. - ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમની
જોગવાઈ અન્વયે કલમ-17 ની પેટા કલમ (1) ના ખંડ (ગ) હેઠળ સરકારશ્રીએ મંજૂર કરેલ દ્રિતિય પુનરાવર્તિત
વિકાસ યોજના મુજબ રહેણાંક ઓન આર - ૧ માં આવે છે તથા સુચિત ૩૬.૦૦ મી. રસ્તા ની અસર થાય છે.



આસીસ્ટન્ટ/ જુનિયર ટાઉન પ્લાનર
શહેરી વિકાસ સત્તામંડળ
વડોદરા

SHREE VINAYAK BUILDCON

પાર્ટનર
PARTNER



વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ

ગુડા ભવન, એલ. એન્ડ. ટી સર્કલ, કારેલીબાગ, વડોદરા-૩૯૦૦૧૮

ક્રમાંક:યુડીએ/ઝોન સર્ટી/78705/2019

તારીખ : 27 Nov 2019

સર્ટી નંબર : 78705

ચલન નંબર : 225305

પ્રતિ: મહેષભાઈ નારણભાઈ રબારી

વિષય: મંજૂર દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજનાના ઝોન અંગેનું સર્ટીફિકેટ
(તા. 18-01-2012 થી અમલી)

અનુ.: આપની તા. 27/11/2019 ની અરજી બાબત

ઉપરોક્ત વિષયે સરકાર શ્રી દ્વારા મંજૂર થઈ અમલમાં આવેલ દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના/ સરકારશ્રીએ મંજૂર કરેલ ફેરફાર/મુજબ મોજે દંતેશ્વર તાલુકે વડોદરા એફ.પી.નં./રે.સ.નં./બ્લોક નં. ૪૧૨ વીએમસી/વુડા/ટી.પી.સી.મ.નં. - ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમની જોગવાઈ અન્વયે કલમ-17 ની પેટા કલમ (1) ના ખંડ (ગ) હેઠળ સરકારશ્રીએ મંજૂર કરેલ દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના મુજબ રહેણાંક ઝોન આર - ૧ માં આવે છે તથા સુચિત ૩૬.૦૦ મી. રસ્તો પસાર થાય છે.



આસિસ્ટન્ટ/જુનીયર ટાઉન પ્લાનર
શહેરી વિકાસ સત્તામંડળ
વડોદરા

SHREE VINAYAK BUILDCON

પરિવર્તન
PARTNER



વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ ની કલમ-૧૭ ની પેટા કલમ(૧)ના ખંડ(ગ) હેઠળ સરકારશ્રીએ મંજૂર કરેલ તથા તા.૧૮-૦૧-૨૦૧૨ થી અમલ માં આવેલ દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના પરત્વેનો વિભાગીય નકશો.

મોજે દંતેશ્વર

તાલુકા


વડોદરા

ના રે.સ.નં./ બ્લોકનં./ ફા/પ્લોટ નં.

૪૧૦, ૪૧૧, ૪૧૨

પુડા/વી.એમ.સી/ટી.પી.સ્કીમ નં.

-



ક્રમાંક ચુડીએ/પ્લાન/ મં.દિ.પુ.વિ.ચો/ ૨૨૫૩૦૫ /૨૦૧૯

તારીખ: ૩૦/૧૫/ ૨૦૧૯


સૂચિ:-


□ રહેણાંક ઝોન (આર-૧)


▨ સુચિત રસ્તા



૧ સે.મી. = ૩૮.૪૦ મીટર


તૈયાર કરનાર


નકલ તપાસનાર



જુનીયર ટાઉન પ્લાનર
શહેરી વિકાસ સત્તામંડળ
વડોદરા.

SHREE VINAYAK BUILDCON



PARTNER

PLAN SHOWING PART PLAN FOR FUTURE REQUIREMENT OF LAND FOR PUBLIC PURPOSE & LAND FOR PLANNING



SIGN. :

DY. TDO (B.P.)

[Signature]
9/11/2020

SR. ARCHITECT

[Signature]

DY. TDO (T.P.)

[Signature]
9/11/2020

LEO (T.P.)

[Signature]
9/11/2020

R.S.NO	AREA AS PER 7/12 & DILR (SQ. MT)
R.S. NO. 410 A	2433.00
R.S.NO. 410 B	988.00
R.S.NO. 411	926.00
R.S.NO. 412 A	1772.00
R.S.NO. 412 B	1057.00
R.S.NO. 414	2833.00
R.S.NO. 414/1	2023.00




ROAD CUTTING AREA

ALL DIMENSIONS ARE IN METRES.

VILLAGE	R.S.NO.	TOTAL AREA AS PER 7/12	ORIGINAL LAND		RECONSTITUTED LAND	
			NO	AREA	NO	AREA
DANTESHWAR	410/A, 410/B, 411, 412/A, 412/B, 414, 414/1	12032.00 SQ.MT.	0	12032.00 SQ.MT.	0	7219.20 SQ.MT.

NOTE: The net plot area which is to be considered for the purpose of development permission is 7219.20 sq.mt. and the dimensions of which are as shown in the drawing above.



SHREE VINAYAK BUILDCON

[Signature]

PARTNER